

M.Com Semester - 2 (CBCS) Examination
March/April- 2019 (New Course)
Corporate Financial Reporting (CORE COURSE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 મહેશ લિ. ના પાકા સરવૈયા નીચે આપેલા છે. સમાન કદનાં નાણાકીય પત્રકની ટેકનિકની મદદથી (20)
 નાણાકીય આર્થિક સ્થિતિ વિશે વિવેચન કરો.

જવાબદારીઓ	31-3-2017 રૂ.	31-3-2018 રૂ.
ઈક્વિટી શેરમૂડી	1,00,000	2,00,000
પ્રેફરન્સ શેરમૂડી	20,000	40,000
સામાન્ય અનામત	20,000	50,000
નફા - નુકસાન ખાતું	40,000	60,000
લેણદારો	20,000	40,000
ચૂકવવાના બાકી ખર્ચા	10,000	10,000
	2,10,000	4,00,000
મિલકતો	31-3-2017 રૂ.	31-3-2018 રૂ.
કાયમી મિલકતો	80,000	2,00,000
રોકાણો	60,000	20,000
દેવાદારો	40,000	80,000
આખરસ્ટોક	20,000	80,000
રોકડ	10,000	20,000
	2,10,000	4,00,000

અથવા

પ્રશ્ન-1 નીચેની માહિતી ઉપરથી તા.31-3-2018 નાં રોજ મોના લિમિટેડનું પાકુ સરવૈયું તૈયાર કરો. (20)

ચાલુ ગુણોત્તર	2.5
પ્રવાહી ગુણોત્તર	1.5
ચોખ્ખી કાર્યશીલ મુડી	રૂ.3,00,000
સ્ટોક ચલનદર(વેચેલ માલની પડતર/આખરમાલ)	6 વખત
કાચા નફાનો ગુણોત્તર	20%
કાયમી મિલકતોના ઉથલાનો ગુણોત્તર(વેચેલ માલની પડતર)	2 વખત
સરેરાશ ઉઘરાણીની મુદત(દેવાદાર ગુણોત્તર)	2 મહિના
કાયમી મિલકતો સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.80
અનામત અને વધારા સાથે શેરમૂડીનું પ્રમાણ	0.50
લાંબાગાળાની લોન સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.20

પ્રશ્ન-2 જીએનએસ કંપનીનું તા.31-03-2017નાં રોજનું પાકુ સરવૈયું નીચે પ્રમાણે છે.

(20)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઈક્વિટી શેરમૂડી	10,00,000	કાયમી મિલકતો	12,00,000
અનામતો	4,00,000	સ્ટોક	2,00,000
તારણવાળી લોન	4,00,000	દેવાદારો	4,00,000
લેણદારો	2,00,000	રોકડ - બેંક	2,00,000
	20,00,000		20,00,000

વર્ષ 2017-18 દરમિયાન કુલ ખરીદ - વેચાણ અને સંચાલનખર્ચા અનુક્રમે રૂ.10,00,000, રૂ.16,00,000 અને રૂ.2,00,000 હતા.

કાયમી મિલકતો પર 10% લેખે ધસારો ગણાય છે. તા.31-03-2018 નાં રોજ સ્ટોક રૂ.3,20,000, દેવાદારો રૂ. 5,00,000, લેણદારો રૂ.2,40,000 અને રોકડસિલક રૂ.5,40,000 હતાં.

સામાન્ય ભાવ સપાટીના આંક નીચે મુજબ હતાં.

તા. 31-03-2017 નાં રોજ	400
તા. 31-03-2018 નાં રોજ	600
વર્ષ 2017-18 સરેરાશ	480

ઉપરથી માહિતિને આધારે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ તેમજ વર્તમાન ખરીદશક્તિ (CPP) પદ્ધતિ મુજબ ભાવ સપાટીમાં થયેલાં ફેરફારની અસર આપી વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-2 “X” લિ.નું તા.31-3-2017 નાં રોજનું પાકુ સરવૈયું નીચે મુજબ છે.

(20)

જવાબદારી	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
ઈક્વિટી શેરમૂડી	6,00,000	કાયમી મિલકતો	9,60,000
અનામત અને વધારો	2,00,000	સ્ટોક	2,40,000
લેણદારો	3,00,000	દેવાદારો	2,00,000
દેવીહૂંડી	3,00,000		
	14,00,000		14,00,000

2017-18 નાં વર્ષ દરમિયાન નીચે મુજબના વ્યવહારો થયા હતા.

વિગત	રૂ.
વેચાણ	19,20,000
વેચેલ માલની પડતર (પુનઃસ્થાપના પડતર મુજબ)	8,40,000
ખરીદી (ઐતિહાસિક પડતર મુજબ)	6,00,000
આખર સ્ટોક (ઐતિહાસિક પડતર મુજબ)	1,68,000
આખર સ્ટોક (પુનઃસ્થાપના પડતર મુજબ)	2,01,600
કાયમી મિલકતો (તા.31-3-2018 નાં રોજ, પુનઃસ્થાપના પડતર મુજબ)	11,52,000

કાયમી મિલકતોનું આયુષ્ય 5 વર્ષનું છે અને અંદાજિત આયુષ્યનાં અંતે તેની કોઈ ભંગાર કિંમત ઉપજશે નહીં.

ઉપરની માહિતિ પરથી વર્તમાન પડતર પદ્ધતિ મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્રશ્ન-૩ જમન કંપનીના નીચેના આવક - ખર્ચ પત્રક પરથી મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

(15)

વિગત	રૂ.	રૂ.
વેચાણ	34,00,000	
અન્ય આવકો	<u>4,00,000</u>	38,00,000
બાદ: માલસામાન - પડતર	8,00,000	
મજૂરી	6,00,000	
વીમાપ્રિમિયમ	1,00,000	
ઓડિટ ફી	40,000	
સ્ટેશનરી	10,000	
વીજળી ખર્ચા	1,20,000	
ભાડુ	10,000	
મુસાફરી ખર્ચા	20,000	
ઘસારો	1,10,000	
વ્યાજ	<u>90,000</u>	<u>19,00,000</u>
		19,00,000
બાદ: કરવેરા	8,00,000	
મૂલ્યવૃદ્ધિ કર	<u>1,00,000</u>	<u>9,00,000</u>
કરબાદનો નફો		10,00,000
બાદ: ઇક્વિટી ડિવિડન્ડ		<u>4,00,000</u>
રાખી મૂકેલ કમાણી		<u>6,00,000</u>

અથવા

પ્રશ્ન-૩ આર્થિક મૂલ્ય વૃદ્ધિ અને બજારમૂલ્ય વૃદ્ધિ વિશે સમજાવો.

(15)

પ્રશ્ન-૪ કંપનીલક્ષી નાણાકીય અહેવાલપ્રેષણનો અર્થ અને હેતુઓ સમજાવો.

(15)

અથવા

પ્રશ્ન-૪ નાણાકીય અહેવાલપ્રેષણ માહિતિનું ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ સમજાવો.

(15)

ENGLISH VERSION

Que-1 The Balance Sheets of Mahesh Ltd are given as under. Interpret Financial Economical position with the help of the technique of common size financial statements: (20)

Liabilities	31-3-2017 Rs.	31-3-2018 Rs.
Equity share capital	1,00,000	2,00,000
Preference Share Capital	20,000	40,000
General Reserve	20,000	50,000
Profit and Loss Account	40,000	60,000
Creditors	20,000	40,000
Outstanding Expenses	10,000	10,000
	2,10,000	4,00,000
Assets	31-3-2017 Rs.	31-3-2018 Rs.
Fixed Assets	80,000	2,00,000
Investments	60,000	20,000
Debtors	40,000	80,000
Closing Stock	20,000	80,000
Cash	10,000	20,000
	2,10,000	4,00,000

OR

Que-1 From the following particulars, prepare balance sheet of Monu Ltd. as on 31-3-2018.. (20)

Current Ratio	2.5
Liquid Ratio	1.5
Net working capital	Rs.3,00,000
Stock Turnover(cost of sales/closing stock)	6 Times
Gross profit ratio	20%
Fixed Assets turnover ratio (cost of goods sold)	2 Times
Average collection period (Debtors Ratio)	2 months
Fixed assets to share holder's funds	0.80
Reserve and surplus to share capital	0.50
Long term loan to share holder's funds	0.20

Que-2 Following is the balance sheet of Jignesh company as on 31-03-2017. (20)

Liabilities	Rs.	Assets	Rs.
Equity Share Capital	10,00,000	Fix assets	12,00,000
Reserves	4,00,000	Stocks	2,00,000
Mortgage loan	4,00,000	Debtors	4,00,000
Creditors	2,00,000	Cash – bank	2,00,000
	20,00,000		20,00,000

During year 2017-18 total purchase, sale and administrative expenses are Rs.10,00,000, Rs. 16,00,000 and Rs. 2,00,000 each respectively.

Calculate 10% depreciation on fix assets, Rs. 3,20,000 is stock, Rs. 5,00,000. Is debtors, Rs. 2,40,000 is creditors and Rs. 5,40,000 is on cash on hand as on Dt. 31-03-2018.

Normal Price base index is as follows:-

Dt. 31-03-2017 400

Dt. 31-03-2018 600

Average of year 2017-18 480

Use above information and prepare find accounts as per historical cost method and current purchasing power method. (CPP).

OR

Que-2 The Balance sheet of “X” Ltd. as on 31-3-2017 is as follows: (20)

Liabilities	Rs.	Assets	Rs.
Equity shade capital	6,00,000	Fixed assets	9,60,000
Reserve and surplus	2,00,000	Stock	2,40,000
Creditors	3,00,000	Debtors	2,00,000
Bills payable	3,00,000		
	14,00,000		14,00,000

Transactions during the year 2017-18 were as follows:

Particular	RS.
Sales	19,20,000
Cost of sales (as per replacement Cost)	8,40,000
Purchase (As per historical cost)	6,00,000
Closing stock (As per historical cost)	1,68,000
Closing stock (As per replacement cost)	2,01,600
Fixed Assets (As on 31-03-2018,As per Replacement Cost)	11,52,000

The estimated life of fixed assets Is 5 years and estimated scrap value at the end of estimated life is nil.

From The above Information prepare final account as per “current cost accounting” Method.

Que-3 From Income – Expense statement of Juman company. Prepare valued added statement. (15)

	<u>Particularar</u>	<u>Rs.</u>	<u>Rs.</u>
	Sales	34,00,000	
	Other Incomes	<u>4,00,000</u>	38,00,000
Less:	Cost of materials	8,00,000	
	Labour	6,00,000	
	Insurance premium	1,00,000	
	Audit fees	40,000	
	Stationary	10,000	
	Electricity expenses	1,20,000	
	Rent	10,000	
	Travelling expenses	20,000	
	Depreciation	1,10,000	
	Interest	<u>90,000</u>	<u>19,00,000</u>
			19,00,000
Less:	Taxation	8,00,000	
	Valued Added tax	<u>1,00,000</u>	<u>9,00,000</u>
	Profit after tax (PAT)		10,00,000
Less:	Equity Dividend		<u>4,00,000</u>
	Retained Earnings		<u>6,00,000</u>

OR

Que-3 Explain about economic value added and market value added. (15)

Que-4 Explain the meaning and objectives of corporate financial reporting. (15)

OR

Que-4 Explain the qualitative characteristics of financial reporting information. (15)
